

બ્રામ્પટન તમામ વિક્રેતાઓને (વેન્ડર્સને) આ શહેરમાં ધંધો કરવા આવકારે છે

બ્રામ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 2, 2019) - સીટી ઓફ બ્રામ્પટનને વિક્રેતાઓને આ શહેરમાં ધંધો કરવા માટે લોકો, સાધનો અને પ્રક્રિયાઓ સાથે જોડવામાં મદદ મળી રહે તે માટે પોતાના 2^{જા} વાર્ષિક રિવર્સ વેન્ડર ટ્રેડ-શો અને સેમિનાર્સનું આયોજન ગુરુવાર, મે 2, 2019 નાં રોજ સવારે 9:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી સીટી હોલમાં કર્યું છે.

જો વિક્રેતાઓ પાસે તેઓ સીટી ઓફ બ્રામ્પટનમાં વેચવા માગતા હોય તેવો માલસામાન કે સેવાઓ હોય, પરંતુ તે કરવાની રીત અંગે તેઓ અચોક્કસ હોય તો, પછી તેઓના કેલેન્ડર્સમાં આગામી મે 2 એક નોંધવાલાયક તારીખ છે. હાજર રહેવા ઇચ્છુક વિક્રેતાઓએ ઓનલાઇન નોંધણી અહીં અચૂક કરાવવી, www.brampton.ca/ReverseVendorTradeshaw.

ટ્રેડ-શોમાં, શહેરી વિભાગોમાંથી પ્રતિનિધિઓ પ્રશ્નોના જવાબ આપવા અને શહેરમાં ધંધો કરવા અંગે માહિતી પૂરી પાડવા હાજર રહેશે. વિક્રેતાઓ પાસે શહેરી કર્મચારીગણ સાથે જોડાવાની અને તેઓ બોલી લગાવી શકે તેવા ખરીદીના પ્રકારો વિશે શીખવાની તક રહેશે.

ટ્રેડ-શોની સાથે સાથે ચાલનારા ટૂંકા સેમિનાર્સ શહેરમાં ધંધો કરવાની રીત પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ગયા વર્ષે બ્રામ્પટનમાં રિવર્સ વેન્ડર ટ્રેડ-શો યોજાયો ત્યારથી શહેર સાથે 120 કરતા વધારે નવા વિક્રેતાઓએ નોંધણી કરાવી છે.

ઝાંખીઓ

- રિવર્સ વેન્ડર ટ્રેડ-શો ગુરુવાર, મે 2 નાં રોજ સવારે 9:30 થી બપોરે 12:30 વાગ્યા સુધીના સમયમાં આ સરનામે યોજાશે: The Conservatory, City Hall, 2 Wellington Street West. (ધી કન્ઝર્વેટરી, સીટી હોલ, 2 વેલિંગ્ટન સ્ટ્રીટ વેસ્ટ.)
- સીટી ઓફ બ્રામ્પટનના ડિવિઝનોમાંથી પ્રતિનિધિઓ વાતચીત કરવા ઉપલબ્ધ રહેશે.
- 30 મિનિટનો સેમિનાર સવારે 10 થી 10:30 વાગ્યા સુધી અને પછી સવારે 11:30 થી બપોર સુધી West Tower (WT) Training Room 2A (વેસ્ટ ટાવર ટ્રેઇનિંગ રૂમ 2A) માં યોજાશે. આ શહેરમાં ધંધો કરવાની રીત પર ધ્યાન કેન્દ્રિત કરશે.
- કર્મચારીગણ વિક્રેતાઓને આ વેબસાઇટ પર નોંધણી કરવામાં મદદરૂપ થવા ઉપલબ્ધ રહેશે, BidsandTenders.ca.
- અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ અહીં ઉપલબ્ધ છે: 2 Wellington Street West અને 41 George Street South.

અવતરણ (ક્વોટ):

“બ્રામ્પટન તમામ ધંધાઓ, મોટા અને નાના, સૌને આ શહેરમાં તેઓ કેવી રીતે વેચાણ કરી શકે છે તે વિશે શીખવા માટે આ આયોજનમાં આવવા આવકારે છે. દર વર્ષે, આ શહેર \$250 મિલિયન ઉપરાંતનો માલસામાન, સર્વિસીસ અને બાંધકામની ખરીદી કરે છે. રિવર્સ વેન્ડર ટ્રેડ-શો વિક્રેતાઓ માટે શહેરી વિભાગોમાંથી કર્મચારીગણ સાથે વાર્તાલાપ કરવાની અને પોતાના પ્રશ્નોના જવાબ મેળવવાની એક આદર્શ તક છે. અમે સ્થાનિક ધંધાઓને સહાયતા કરવા અને નિષ્પક્ષ અને પારદર્શક ખરીદી વ્યવહારો અનુસરવા કટિબદ્ધ છીએ.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

मिडिया संपर्क:

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया अँड कम्युनिटी अँगेजमेन्ट

व्युत्पत्तिक संवाद

सीटी ओफ़ ब्रॅम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca